



જનસંપર્ક અધીકારી દ્વારા

પોલીસ કમિશનરશ્રીની કચેરી, અમદાવાદ શહેર

ટેલીફોન નંબર ૨૫૬૩૩૩૩૩



કંટ્રોલરૂમ ટેલી.નં. ૨૫૬૩૦૧૦૦, ૨૫૬૩૦૨૦૦, ૨૫૬૩૦૪૦૦ ફેક્સ: ૨૫૬૩૦૬૦૦

તા ૧૨/૦૭/૨૦૧૯ શુક્રવાર

અમદાવાદ શહેર પોલીસ સમાચાર

નશાબંધી તથા જુગાર ધારા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૧૧૬૪/૧૯

શહેર પોલીસે ગઈકાલે નશાબંધી ધારા હેઠળ ૪૨ કેસ કરી, ૩૫ વ્યક્તિઓને ઝડપી, ૩૯૦ લીટર દેશી દારૂ, ૧૩૪ બોટલ ઈંગ્લીશ દારૂ, ૪૦ ક્વાર્ટર ઈંગ્લીશ દારૂ, ૧૦ બિયર ટીન અને ૧ ટ્રક કબજે કરી હતી. તેમજ જુગાર ધારા હેઠળ ૨ કેસ કરી, ૫ વ્યક્તિઓને ઝડપી રોકડ રૂપિયા ૬૫૯૦/- અને જુગારના સાધનો કબજે કર્યા હતા.

તકેદારીના પગલા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૧૧૬૫/૧૯

શહેર પોલીસે ગઈકાલે તકેદારીના પગલા હેઠળ સી.આર.પી.સી.૧૦૭,૧૦૯,૧૧૦,૧૫૧ મુજબ કુલ ૧૫૭ વ્યક્તિઓની અટકાયત કરી હતી. તેમજ પ્રોહી ૯૩ મુજબ ૬ વ્યક્તિઓની અને પાસા હેઠળ ૫ વ્યક્તિઓની અટકાયત કરી હતી.

ઘરફોડ:-

સમાચાર યાદી નં.૧૧૬૬/૧૯

એલીસબ્રીજ: મહેન્દ્રભાઈ માનચંદભાઈ શાહ (રહે. રિધમ બંગલો વાસણા કોમ્યુનીટી હોલ સામે વાસણા) એ તા.૧૧/૦૭/૧૯ નારોજ એલીસબ્રીજ પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૧૯/૦૬/૧૯ રાતના ૮/૩૦ થી તા.૨૦/૦૬/૧૯ કલાક ૮/૩૦ વાગ્યા દરમિયાન એલીસબ્રીજ ગુજરાત કોલેજની બાજુમા ઓરીયન્ટ ક્લબ સામે વોલ સ્ટ્રીક વિભાગ-૧ બિલ્ડીંગમા ઓફીસ નંબર-૪૦૧,૪૦૨ ના દરવાજાના નકુચા તોડી અજાણી વ્યક્તિ ઓફીસમાં પ્રવેશ કરી સોનાની વિંટી કિંમત રૂપિયા ૩૦,૦૦૦/-, ચાંદીની લગડી કિંમત રૂપિયા ૧૦,૦૦૦/- મોબાઈલ ફોન કિંમત રૂપિયા ૩૦૦૦/- અને રોકડ રૂપિયા ૨૭૦૦/- મળી કુલ રૂપિયા ૪૫,૭૦૦/- મતાની ચોરી કરી લઈ ગઈ છે. આ ગુનાની તપાસ પો.સ.ઈ.શ્રી એ.પી.જેબલીયા ચલાવે છે.

સરખેજ: નિલેશભાઈ અરવિંદભાઈ જાદવ (રહે. વિનાયકા હોમ્સ ગોકુલમ ફ્લેટ આગળ ઉજાલા હોટલ પાછળ સરખેજ) એ સરખેજ પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૧૦/૦૭/૧૯ રાતના ૯/૧૫ થી તા.૧૧/૦૭/૧૯ કલાક ૯/૦૦ વાગ્યા દરમિયાન પોતાના મકાનના દરવાજાના નકુચા તોડી અજાણી વ્યક્તિ ઘરમાં પ્રવેશ કરી તીજોરીમાંથી સોનાની બુટ્ટી કિંમત રૂપિયા ૨૦,૦૦૦/-, ચાંદીની પાયલ કિંમત રૂપિયા ૩૦૦૦/- અને રોકડ રૂપિયા ૧૪,૦૦૦/- મળી કુલ રૂપિયા ૩૭,૦૦૦/- મતાની ચોરી કરી લઈ ગઈ છે. આ ગુનાની તપાસ પો.સ.ઈ.શ્રી ડી.સી.પરમાર ચલાવે છે.

નરોડા: પંકજભાઈ અંબાલાલ સુથાર (રહે. કૈલાશ કોમ્પલેક્સ હરીઓમ દાલબાટીની બાજુમા બેઠક રોડ નરોડા) એ નરોડા પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૧૧/૦૭/૧૯ સવારના ૧૧/૪૫ થી બપોરના ૧૨/૩૦ વાગ્યા દરમ્યાન પોતાના મકાનના દરવાજાનુ તાળુ તોડી અજાણી વ્યક્તિ પ્રવેશ કરી સોના-ચાંદીના દાગીના કિંમત રૂપિયા ૧,૩૪,૩૦૦/- અને રોકડ રૂપિયા ૪૩,૦૦૦/- તેમજ સાહેદ રાજુભાઈ મંગાભાઈ શમાના મકાનમાંથી રૂપિયા ૫૦,૦૦૦/- ભરેલ ગલ્લો મળી કુલ રૂપિયા ૨,૨૭,૩૦૦/- મતાની ચોરી કરી લઈ ગઈ છે. આ ગુનાની તપાસ પો.ઈ.શ્રી એચ.બી.વાઘેલા ચલાવે છે.

ચોરી:-

સમાચાર યાદી નં.૧૧૬૭/૧૯

ચાંદખેડા: અમનદિપ પરમવિરસિંગ સંધુ (રહે. શહજાનંદ વિલ-૦૨ ન્યુ સી.જી.રોડ ચાંદખેડા) એ ચાંદખેડા પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૧૦/૦૭/૧૯ સવારના ૧૦/૦૦ થી બપોરના ૧૨/૦૦ વાગ્યા દરમ્યાન પોતાના ઘરે કામ કરવા આવેલ આરોપી જ્યોતિ,પુજા,અને રાહુલ (રહે.ચાંદખેડા ગામ) ઘરમાંથી સોનાની ચેઈન કિંમત રૂપિયા ૩,૭૫,૦૦૦/-, સોનાની વીટી નંગ-૨ કિંમત રૂપિયા ૯૦,૦૦૦/-, સોનાનુ કડું કિંમત રૂપિયા ૧,૨૭,૫૦૦/- મળી કુલ કિંમત રૂપિયા ૫,૯૨,૦૦૦/- ચોરી કરી લઈ ગઈ છે. આ ગુનાની તપાસ પો.સ.ઈ.શ્રી જી.વી.ચૌધરી ચલાવે છે.

ટ્રેઈનની અડફેટે મૃત્યુ:-

સમાચાર યાદી નં.૧૧૬૮/૧૯

જીઆઈડીસી વટવા: વિનોદ ગંગારામ કેવટ (ઉ.વ.૨૧) (રહે. હનુમાનગર જશોદાનગર જીઆઈડીસી વટવા) તા.૧૧/૦૭/૧૯ સાજના ૬/૧૫ વાગ્યાના સુમારે જીઆઈડીસી વટવા પુનિતનગર ફાટકના થાંભલા નંબર ૪૮૯/૧૭ થી ૪૮૯/૧૯ નજીક રેલવેની અડફેટે આવી જતા ગંભીર ઈજાઓ થતા તેમનું મૃત્યુ નિપજયું હતું. આ અંગે જીઆઈડીસી વટવા પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ પો.સ.ઈ.શ્રી એ.બી.રાઠોડ ચલાવે છે.

ઘાબા ઉપરથી પડી જતાં મૃત્યુ :-

સમાચાર યાદી નં.૧૧૬૯/૧૯

ખોખરા: હરીકેશ છત્રોહન યાદવ (ઉ.વ.૨૩) (રહે. માસ્તરની ચાલી હરીપુરા ખોખરા) તા.૪/૭/૧૯ રાતના ૩/૩૦ વાગ્યાના સુમારે પોતાના રહેણાંકના ઘાબા પરથી પડી જતા ગંભીર ઈજાઓ થતા સારવાર માટે તેમને એલ.જી.હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમ્યાન તા.૧૧/૭/૧૯ બપોરના ૧૨/૪૫ વાગે તેમનું મૃત્યુ નિપજયું હતું. આ અંગે ખોખરા પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ પો.સ.ઈ.શ્રી આર.પી.મકવાણા ચલાવે છે.

આત્મહત્યા:-

સમાચાર યાદી નં.૧૧૭૦/૧૯

દાણીલીમડા: મિસ્બા વા/ઓ સોહેબભાઈ છીપા (ઉ.વ.૨૦) (રહે. ભીલવાસ વાસુદેવ ધનજીની ચાલી પરીક્ષિતલાલનગર બ્લોક નંબર-૮ ની બાજુમા દાણીલીમડા) એ અગમ્ય કારણસર તા.૧૧/૦૭/૧૯ કલાક ૬/૧૮ વાગ્યા પહેલા પોતાના ઘરે ગળેફાસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગે દાણીલીમડા પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ મદદનીશ પોલીસ કમિશન શ્રી “કે” વિભાગ ચલાવે છે.

એરપોર્ટ: પુનમબહેન જયકિશન સુજનાની (રહે. જોગણીમાતાના છાપરાં ભદ્રેશ્વર સરદારનગર) એ અગમ્ય કારણસર તા.૧૧/૭/૧૯ બપોરના ૨/૩૦ વાગ્યાના સુમારે પોતાના ઘરે ગળેફાસો ખાઇ આત્મહત્યા કરી હતી. આ અંગે એરપોર્ટ પોલીસે અકસ્માત મોત નોધી આ અંગેની તપાસ પો.સ.ઇ. શ્રી જે.જે.ચૌધરી ચલાવે છે.

નરોડા: ભગવતી પ્રસાદ ઉર્ફે બબલુ (ઉ.વ.૩૭) (રહે. ગાયત્રીનગર સોસાયટી એક્સીલેન્ટ સ્કુલની બાજુમા કુનેરેશ્વર મહાદેવ મંદીર સામે કૃષ્ણનગર) એ બેકારીથી કંટાળી તા.૧૧/૭/૧૯ બપોરના ૧૨/૦૦ થી ૨/૩૦ વાગ્યાના સુમારે સૈજપુર ટાવર બી.આર.ટી.એસ.બસ સ્ટોપ સામે જાહેર શૌચાલયની બાજુમા ઝાડ ઉપર કપડું બાંધી ગળેફાસો ખાઇ આત્મહત્યા કરી હતી. આ અંગે નરોડા પોલીસે અકસ્માત મોત નોધી આ અંગેની તપાસ હે.કો.શ્રી વિરેંદ્રસિંહ ભગવાનસિંહ ચલાવે છે.

નાયબ પોલીસ કમિશનર,
કંટ્રોલરૂમ, અ'વાદ શહેર.
પોલીસ કમિશનર વતી.